

S.D.ARTS & B.R.COMMERCE COLLEGE,MANSA

UGBA SEM-III [Gujarati] core Paper-201

MCQ-Prepared By Assi. Prof. Hemlataben B. Mehta

પ્રશ્નોનો અને તેનાં જવાબ

૧. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નિબંધકારના લેખકનું નામ જણાવો. - નર્મદ
૨. વિશ્વ સાહિત્યમાં પ્રથમ નિબંધકારના લેખકનું નામ જણાવો. - મોન્ટેઇન
૩. નિબંધમાં પોતાની જાતને ચીતરવાની હોય છે એવું કયા નિબંધકારે કહ્યું છે ? - મોન્ટેઇન
૪. 'નિબંધ લખવા જેવી તેવી વાત નથી' - આ વાક્ય કોણ કહે છે? - નર્મદ
૫. દલપતરામના શ્રેષ્ઠ નિબંધનું નામ જણાવો. - 'ભૂતનિબંધ'
૬. 'દક્ષિણાયન' પ્રવાસ નિબંધના લેખકનું નામ જણાવો. - સુન્દરમ
૭. ઉમાશંકર જોશી અને સુન્દરમ કયા યુગના નિબંધકારો છે? - ગાંધીયુગના .૮.
'દૂરના એ સૂર' નિબંધસંગ્રહના લેખકનું નામ જણાવો. - દિગ્વીશ મહેતા
૮. નિબંધના કયા બે પ્રકારો સર્વસ્વીકૃત છે? - લલિત અને લલિતેતર
૧૦. નિબંધ અને ઉર્મિકાવ્ય એ કેવા પ્રકારનું સર્જન છે? - આત્મલક્ષી
૧૧. પ્રવીણ દરજીએ કયા સામાયિકમાં માનાઈ સંપાદક તરીકે કામ કર્યું? - 'શબ્દસૃષ્ટિ'
૧૨. 'નિરાવૃત' લલિત નિબંધસંગ્રહના સંપાદકનું નામ જણાવો. - પ્રવીણ દરજી
૧૩. 'નિરાવૃત' સંગ્રહને કેવા પ્રકારનો નિબંધસંગ્રહ ગણાવી શકાય? - લલિતનિબંધસંગ્રહ
૧૪. 'નિરાવૃત' લલિત નિબંધસંગ્રહની પ્રથમ આવૃત્તિ કઈ સાલમાં પ્રકાશિત થઈ? - સપ્ટે.૨૦૦૭
૧૫. તમારા અભ્યાસક્રમ આધારિત 'નિરાવૃત' નિબંધસંગ્રહમાં કેટલા નિબંધો આપ્યા છે? - ૨૫
૧૬. 'નિરાવૃત' સંગ્રહનો પહેલો નિબંધ કયો આપ્યો છે? - ઓરડો
૧૭. 'ઓરડો' લલિત નિબંધનો પ્રકાર જણાવો. - સ્થળવિશેષ
૧૮. ઓરડામાં 'મેજિકલ કોટ' જેવું શું હતું? - લાકડાનું કબાટ
૧૯. 'ડિપોટી સાહેબ' એટલે શું? - ડેપ્યુટી સાહેબ
૨૦. 'ડિપોટી સાહેબ' કયા પ્રકારનો લલિત નિબંધ છે? - વ્યક્તિવિશેષ
૨૧. 'ટેશન' શબ્દનો સ્પષ્ટ ભાવાર્થ શો થાય છે? - સ્ટેશન
૨૨. 'ટેશન' કયા પ્રકારનો નિબંધ ગણાવી શકાય છે? - છે? - સ્થળવિશેષ
૨૩. 'ડગલો' નિબંધ લેખકે કઈ શૈલીમાં રચેલો છે? - દ્વિઅર્થી
૨૪. 'ફળિયું' લલિત નિબંધનો પ્રકાર જણાવો. - સ્થળવિશેષ
૨૫. ફળિયામાં રહેતા ડોક્ટરનું નામ શું હતું? - મણિકાકા (મણિલાલ)
૨૬. 'મહા' નિબંધમાં 'મહા' મહિનાને લેખકે કેવો કહ્યો છે? - વિષાદી મહિનો
૨૭. પાણીના નવા નવા રૂપની ચર્ચા લેખકે કયા લલિત નિબંધમાં કરી છે? - 'હા, હું જલ છું'
૨૮. લેખકનાં દાદીનું અસ્થિવિસર્જન કયાં થયું હતું? - ચાણોદ
૨૯. પશવા પાણીવાળાનું સાચું નામ જણાવો. - પુરુષોત્તમ
૩૦. પશવા પાણીવાળાનો મુખ્ય વ્યવસાય શો હતો? - લોકોના ઘરેપાણી ભરવાનો
૩૧. પશવો પાણીવાળો લેખકને કયા નામથી બોલાવતો હતો? - બચુભાઈ
૩૨. 'શબ્દો...શબ્દો...શબ્દો...' નિબંધમાં લેખકે શબ્દોને કોના જેવા કહ્યા છે? - હેલેનેના જેવા
૩૩. 'સમય' લલિત નિબંધમાં મૂળ શેની વાત કરી છે? - સમયના વ્યૂહની
૩૪. 'કૃષ્ણ... કૃષ્ણ... કૃષ્ણ...' કયા પ્રકારનો લલિત નિબંધ છે? - વ્યક્તિવિશેષ
૩૫. ખિસકોલીઓને સર્જકે કેવી ચીતરી છે? - નટખટ
૩૬. 'ખિસકોલીઓ' પ્રકરણમાં લેખકે કેટલી ખિસકોલીઓની વાત કરી છે? - ચાર
૩૭. 'બધું જ યાદ છે!' લલિત નિબંધનો મુખ્ય વિષય શો છે? - વતનપ્રેમ
૩૮. 'લીન છું - મારામાં, તમારામાં!' નિબંધમાં લેખકે મૂળ શેની વાત કરી છે? - પોતાનામાં એકાકાર થવાની
૩૯. 'જૂનું' મેજ અને... નિબંધમાં 'મેજ' કોણે બનાવી આપ્યું હતું? - દલસુખકાકાએ
૪૦. 'લો, વરસાદ ભેટ આપું છું!' નિબંધમાં કયો ધ્વનિ સ્ક્રુટ થાય છે? - આંતર
૪૧. 'કોણ છે રાધા, તું?' કયા પ્રકારનો લલિત નિબંધ છે? - વ્યક્તિવિશેષ
૪૨. 'રસ્તાઓ... રસ્તાઓ...' લલિત નિબંધનો પ્રકાર જણાવો. - સ્થળવિશેષ
૪૩. 'અહો ! વૈભવશાળી કાન !' લલિત નિબંધમાં કેવા કાનનાં વખાણ થયા છે? - મોટા કાનના
૪૪. લેખકના બા કેટલી વયે વાડાની સંભાળ રાખતાં? - ૭૫ વર્ષની
૪૫. 'બાનો વાડો' લલિત નિબંધનો પ્રકાર જણાવો. - સ્થળવિશેષ
૪૬. 'ચાલો, ઇથાકાની સફરે' માં 'ઇથાકા' એટલે શું? - ઓડેસિયસનું વતન
૪૭. 'સગડી પાસે' નિબંધમાં મુખ્ય વિષય શો છે? - શૈશવના સંસ્મરણો
૪૮. 'નિરાવૃત ક્ષણો' લલિતનિબંધમાં લેખકની કઈ વેદનામય યાદોની વાત છે? - પિતાના મૃત્યુની
૪૯. 'નિરાવૃત ક્ષણો' લલિતનિબંધમાં લેખકની કઈ આદતની વાત આવે છે? - ડાયરી લખવાની

૫૦. 'ધરમશાળા' કેવા પ્રકારનો લલિત નિબંધ ગણાવી શકાય? – સ્થળ વિષયક

૫૧. ગુજરાતી સાહિત્યમાં લલિત નિબંધના પગલાં કયા લેખકના નિબંધોમાં દેખાય છે? - કાકાસાહેબ કાલેલકર